

ત્વરિત જાહેરાત માટે

## વર્ષ 2021 માટે fDI Intelligence (એફ.ડી.આઈ. ઇન્ટેલિજન્સ)નું રેન્કિંગ (ક્રમાંકન) બ્રમ્પટનને ભવિષ્યનું અગ્રેસર શહેર અને મુખ્ય રોકાણ સ્થળ તરીકેની સ્થિતિમાં મૂકે છે

બ્રમ્પટન, ઓન્ટેરિયો (જૂન 18, 2021) – આજરોજ, ફાઈનાન્સિયલ ટાઈમ્સ (UK) નું એક ડિવિઝન, fDI ઇન્ટેલિજન્સ દ્વારા અમેરિકન સીટીઝ ઓફ ધી ઈયર એવોર્ડ્સના પરિણામોની ઘોષણા કરવામાં આવી, જેમાં સીટી ઓફ બ્રમ્પટનને ટોચનાં 10 મધ્યમ-કદના ભાવિ અમેરિકી શહેરોની શ્રેણીમાં છઠ્ઠું રેન્કિંગ મળ્યું.

બ્રમ્પટનને ટોચનાં 10 મધ્યમ-કદના ભાવિ અમેરિકી શહેરોની કનેક્ટિવિટી શ્રેણીમાં બીજું, અને FDI વ્યૂહરચના શ્રેણી માટે ટોચનાં 25 અમેરિકી શહેરોમાં બારમું રેન્કિંગ મળ્યું.

બ્રમ્પટનના ફોરેઈન ડાઈરેક્ટ ઇનવેસ્ટમેન્ટ (FDI) પ્રયત્નોએ શહેરના ચાવીરૂપ ક્ષેત્રો પર ધ્યાન આપવાનું ચાલુ રાખ્યું છે: ઈનોવેશન (નવીન શોધ) અને ટેકનોલોજી, આધુનિક ઉત્પાદન, ખાદ્યપદાર્થો અને પીણાં પ્રક્રિયાકરણ, અને આરોગ્ય અને જીવ વિજ્ઞાન. વર્ષ 2020 માં, શહેરની FDI વ્યૂહરચનાના ભાગરૂપે ધંધો જાળવી રાખવો અને વિસ્તારવા પર વધારાનો ભાર મૂકવામાં આવ્યો હતો.

રોકાણ એ શહેરની [આર્થિક રિકવરી વ્યૂહરચના](#)નો ચાવીરૂપ આધાર છે જેને, બ્રમ્પટન સીટી કાઉન્સિલે ગત મે, 2020 માં મંજૂરી આપી હતી. શહેરના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટનો અવિરત વિકાસ વ્યૂહરચનાનો બીજો એક મહત્વનો ભાગ છે. આર્થિક રિકવરી વ્યૂહરચનાનો હેતુ બ્રમ્પટનના અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા અને સ્પર્ધાત્મક લાભ લાવવાનો છે, અને તેનાથી શહેરને COVID-19 વૈશ્વિક મહામારીમાંથી આગળ વધવામાં મદદ મળશે.

બ્રમ્પટનને fDI ઇન્ટેલિજન્સ પાસેથી માન્યતા મળી હોય તેવું આ પહેલી વાર બન્યું નથી. આ રેન્કિંગ્સ દર બે વર્ષે તાજાં (રિન્યુ) કરવામાં આવે છે, અને છેલ્લાં આઠ વર્ષથી, બિઝનેસ ફેન્ડલીનેસ, સીટી ઓફ ધી ફ્યુચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી જેવી શ્રેણીઓમાં બ્રમ્પટન સતતપણે જીત્યું છે અથવા બ્રમ્પટનને ટોચની નજીકનું સ્થાન મેળવ્યું છે.

fDI ઇન્ટેલિજન્સ શહેરને રેન્કિંગ આપતી વખતે પાંચ શ્રેણીઓને ધ્યાનમાં લે છે: આર્થિક સંભવિતતા, ધંધાકીય અનુકૂળતા (બિઝનેસ ફેન્ડલીનેસ), માનવ મૂડી અને જીવનશૈલી, ખર્ચ અસરકારકતા અને કનેક્ટિવિટી.

રેન્કિંગ્સ વિશે સંપૂર્ણ પરિણામો અને વધુ માહિતી [અહીં](#) ઉપલબ્ધ છે.

### અવતરણો (ક્વોટ્સ):

“બ્રમ્પટન એક તકો આપતું શહેર છે જેમાં સ્પર્ધાત્મક પ્રતિભાનો સેતુ નવીન શોધમાં આગેવાની કરે છે. ટોચનાં 10 મધ્યમ-કદના ભાવિ અમેરિકી શહેર તરીકે fDI ઇન્ટેલિજન્સ પાસેથી ફરીથી ઓળખ મળવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. આ એવોર્ડ્સ આપણે પહેલેથી જાણીએ છીએ તેને વધારે મજબૂત બનાવે છે – બ્રમ્પટન એક વર્લ્ડ-ક્લાસ શહેર છે અને વૈશ્વિક ધંધાઓ માટે રોકાણ કરવા જેવું એક મુખ્ય સ્થળ છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“આપણે રિઓપન કરવાનું શરૂ કરી રહ્યાં છીએ અને COVID-19 વૈશ્વિક મહામારીના પ્રભાવોમાંથી આગળ વધી રહ્યાં છીએ ત્યારે, બ્રમ્પટનના અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા અને સ્પર્ધાત્મક લાભ મેળવવામાં રોકાણ મહત્વની ભૂમિકા ભજવશે. fDI ઇન્ટેલિજન્સ પાસેથી

તેઓના અમેરિકન સીટીઝ ઓફ ધી ઈયર એવોર્ડ્સ માટે ફરીથી ઓળખ મળવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ, અને બ્રેમ્પટનને ભાવિ અગ્રણી શહેર બનાવતી બાબતો વિશે વધુ જાણવા બધી વિદેશી કંપનીઓને આવકારીએ છીએ.”

- માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આર્થિક વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“રોકાણ સીટીની આર્થિક રિકવરી વ્યૂહરચનાનો ચાવીરૂપ આધાર છે, અને બ્રેમ્પટન પોતાને નવીન શહેર તરીકેની અને દુનિયાભરના ધંધાઓ માટે મુખ્ય રોકાણ સ્થળ તરીકેની સ્થિતિમાં લાવવા સમર્પિત છે. અમે FDI ની ઓળખને આવકારીએ છીએ કે બ્રેમ્પટન ટોચનું મધ્યમ-કદનું ભાવિ શહેર છે. એક વર્લ્ડ-ક્લાસ શહેર તરીકે, અમારો ભાવાર્થ ધંધાઓનો થાય છે, અને અમે આપણાં સમુદાયમાં વિદેશી રોકાણને આવકારવાની આશા રાખીએ છીએ.”

- પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; ઉપાધ્યક્ષ, આર્થિક વિકાસ અને સંસ્કૃતિ, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન એક તકો આપતું એક શહેર છે, અને કેનેડાના ઈનોવેશન કોરિડોર અને આપણાં સ્પર્ધાત્મક કાર્યબળ પર આપણું મુખ્ય સ્થળ બનીને, આપણે વિદેશી ધંધાઓને આપણી ધરતી પર પગ મૂકાવવા આપણને પોતાને શ્રેષ્ઠ સ્થળ તરીકે સ્થાપવાનું ચાલુ રાખીએ છીએ. સીટી ઓફ બ્રેમ્પટનમાં કર્મચારીગણ વતી, હું FDI ઈન્ટેલિજન્સ પાસેથી ફરીથી ઓળખ મળવા બદલ આપણું ગૌરવ વ્યક્ત કરવા ઈચ્છું છું, અને બ્રેમ્પટન આપી શકે છે તે બધાંની ચર્ચા કરવા આપણાં સમર્પિત આર્થિક વિકાસ કર્મચારીઓ સુધી પહોંચવા વિદેશી ધંધાઓને આવકારું છું.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

#### મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ (Strategic Communication)

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)